

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૬/૧૨/૨૦૧૭ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૪૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૮ કેસ કરી, ૫૧ વ્યક્તિઓને ઝડપી, ૫૪૦ લીટર દેશી દારૂ, ૦૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૫૦ ક્વોર્ટર ઇંગ્લીશ દારૂ અને ૦૧ એક્ટીવા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૩ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૨૪,૬૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૪૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૬૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૫૦/૧૭

શાહીબાગ : દલપતભાઈ મણીલાલ શાહ (ઉ.વ.૭૫)(રહે,સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, ચંદ્રમણી હોસ્પિટલ સામે, ગીરધરનગર, શાહીબાગ) એ તા.૬/૧૨/૧૭ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૧૨/૧૭ ના કલાક ૪/૩૦ થી તા.૬/૧૨/૧૭ ના કલાક ૩/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું લોક ડુપ્લીકેટ ચાવીથી ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલ તિજોરી ડુપ્લીકેટ ચાવીથી ખોલી, જુદા-જુદા સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા ૫,૩૬,૦૦૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.કે.પટેલ ચલાવે છે.

ઓઢવ : જ્યંતિભાઈ વલ્લભભાઈ અડધુક (રહે,ધર્મભુમિ એપાર્ટમેન્ટ સી.ટી.એમ.બરોડા એક્સપ્રેસ રોડ અમરાઈવાડી) એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૧૨/૧૭ રાતના ૮/૦૦ થી તા.૫/૧૨/૧૭ ના કલાક ૪/૧૫ વાગ્યા દરમ્યાન ઓઢવ ખાતે આવેલ પોતાની "અમી" કંપનીનાં કારખાનામાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, લોખંડની તિજોરી કિંમત રૂપિયા ૫,૦૦૦/- તથા તેમા મુકેલ રોકડ રૂપિયા ૧,૧૦,૦૦૦/- તેમજ સી.સી.ટી.વી.નું ડી.વી.આર.મશીન કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા કોટક અલ્હાબાદ, બેંક ઓફ બરોડા વિગેરેની ચેક બુકો, પાસબુક, સ્લીપબુકો તથા પરચુરણ કાગળો મળી કુલ કિંમત રૂપિયા ૧,૧૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી સી.બી.ટંડેલ ચલાવે છે.

ગાડીનો કાચ તોડી ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૫૧/૧૭

ચાંદખેડા : રાજેશ ભગવાનદાસ તોતલાની (ઉ.વ.૩૮)(રહે,નિર્મલ સિઝેચર આદિપ્ત ગ્રીન્સની બાજુમાં ન્યુ સીજી.રોડ ચાંદખેડા) એ તા.૦૫/૧૨/૧૭ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૧૨/૧૭ રાતના ૧૦/૦૦ થી ૧૧/૪૫ વાગ્યા દરમ્યાન મોટેરા એચ.પી.પેટ્રોલપંપની સામેની ગલીમાં આવેલ નરનારાયણ પાર્ટી પ્લોટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ પોતાની કારનો પાછળનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી એપલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૫૭,૦૦૦/- અને ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- તથા અગત્યના દસ્તાવેજો મળી કુલ કિંમત રૂપિયા ૭૨,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ચૌધરી ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૫૨/૧૭

નરોડા : હાર્દિકભાઈ દિલીપભાઈ પટેલ (રહે,મહાવીર બંડોઝ પાયલ નગર નરોડા) એ તા.૦૫/૧૨/૧૭ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧/૧૨/૧૭ રાતનાં ૧૧/૦૦ વાગ્યાના સુમારે નરોડા બેઠક પદમાવતી કોમ્પલેક્ષની ડાબી બાજુમાં પ્રતિમાબેનના દવાખાના કોટની દિવાલ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પોતાની લકઝરી બસ નંબર જીજી.૦૧.ડી.ઝેડ.૨૬૪૭ કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી જેની ચોરી તા.૦૨/૧૨/૧૭ સવારના ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન થઇ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એ.વાઘેલા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૪૫૩/૧૭

ગોમતીપુર : કિરણબેન વા/ઓ મુકેશભાઈ બાબુભાઈ વૈશ્ય (ઉ.વ.૪૧)(રહે,પઠાણની ચાલી વિક્રમમીલ ની સામે ગોમતીપુર) એ પોતાની શ્વાસની અને બી.પી.ની બીમારીથી કંટાળી જઇ, તા.૦૫/૧૨/૧૭ સાંજનાં ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે નાચલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ઝાલા ચલાવે છે.

અમરાઇવાડી : સંદીપકુમાર પરષોત્તમભાઈ હડીયલ (ઉ.વ.૨૨)(રહે, શક્તિનગર વિભાગ-૬ પઠાણની ચાલી ભીલાવાડા અમરાઇવાડી) એ કોઇ અગમ્ય કારણસર તા.૦૫/૧૨/૧૭ ના કલાક ૯/૪૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમણભાઈ કોદરભાઈ ચલાવે છે.

બાપુનગર : દિપક સ/ઓ ચંદુજી ઠાકોર (ઉ.વ.૧૮)(રહે,ફકીરદાસની ચાલી, ચંદ્ર ખમણની પાછળ ભીડભંજન બાપુનગર) એ કોઇ અગમ્ય કારણસર તા.૦૪/૧૨/૧૭ બપોરનાં ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે કોઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટે તેમને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતનાં ૦૮/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુઆ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ચંદુભાઈ વશરામભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.